

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૪/૦૭/૨૦૧૮ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૦૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૦ કેસ કરી, ૨૯ વ્યક્તિઓને ઝડપી, ૨૦૯ લીટર દેશી દારૂ, ૬૬ બોટલ ઇંગ્લીશ દારૂ, ૭૧ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૬૭ બિયર ટીન, ૨ રિક્ષા અને ૩ સ્ફૂટર કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૫ કેસ કરી ૧૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૭,૫૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૦૮/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૪૦૯/૧૮

ખોખરા: પિનાકીન હર્ષદરાય કિનારીવાલા (ઉ.વ.૬૪) (રહે. મહેન્દ્રકુંજ સોસાયટી ગાયત્રી ડેરી પાસે ખોખરા) એ તા.૨૩/૭/૧૮ નારોજ ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે તા. ૧૧/૦૬/૧૮ સવારના ૯/૦૦ થી ૧૦/૨૦ વાગ્યા દરમિયાન આરોપી મોબાઈલ નંબર ૭૦૯૧૮૨૮૬૭૮ ના ધારકે પીનાકીન કિનારીવાલાને ફોન કરી પિનાકીન કિનારીવાલાના બેંકના ખાતાના ડેબીટ કાર્ડ નંબર તથા ડેબીટ કાર્ડનો નંબર તથા ઓ.ટી.પી. નંબર જાણી લઈ યુનિયન બેંક તથા એસ.સી.આઇ.બી.બેંકના ખાતામાંથી કુલ રૂપિયા ૮૭,૮૯૯/- ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી બી.જે.ઝાલા ચલાવે છે.

ઇસનપુર: રસરાજ અંબાલાલ કોષ્ટી (ઉ.વ.૪૫) (રહે. લલીતા સોસાયટી એચ.એલ.પટેલ હોલની બાજુમા લોટસ સ્કુલ પાસે ઇસનપુર) એ તા.૨૩/૭/૧૮ નારોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે તા. ૭/૬/૧૮ થી તા.૧૧/૬/૧૮ સુધીના સમયગાળા દરમિયાન ઇસનપુર દેનાબેન્ક શાખામાંથી અજાણી વ્યક્તિએ રસરાજ કોષ્ટીના ખાતામાંથી ઈન્ટરનેટના માધ્યમથી PAYTM તથા One 97 Communication દ્વારા કુલ રૂપિયા ૭૦,૦૦૦/- ઉપાડી લઈ છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એન.એમ.પટેલ ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૧૪૧૦/૧૮

નરોડા: સુનિતાબહેન શશિપાલ સુથાર (ઉ.વ.૪૦) (રહે. ઉમા પાર્ક સોસાયટી કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે, સૈજપુર બોધા, કૃષ્ણનગર) તા.૨૩/૭/૧૮ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે નરોડા પાટિયાથી નરોડા બેઠક તરફ આવતા રોડ ઉપર આવેલ નેશનલ હેન્ડલુમ સામેથી પતિ સાથે મોટર સાયકલ પાછળ બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક કાળા રંગની પલ્સર મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષો સુનિતાબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સુનિતાબહેને સુથારે નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.કે.ડાભી ચલાવે છે.

નિકોલ: સુરેશભાઈ માધાભાઈ દેસાઈ (રહે. નંદબાગ બંગલોઝ શ્રીનાથ પાર્ટી પ્લોટની બાજુમા નિકોલ) તા.૨૩/૭/૧૮ કલાક ૬/૩૦ વાગ્યાના સુમારે દેવસય ફ્લેટના દરવાજા નજીકથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે એક પલ્સર મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષો સુરેશભાઈ દેસાઈના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સુરેશભાઈ દેસાઈએ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.ડી.હડીયા ચલાવે છે.

આત્મહત્યા :

સમાચાર યાદી નં.૧૪૧૧/૧૮

રામોલ: અસ્તરબહેન ફિલીપભાઈ પરમાર (ઉ.વ.૨૯) (રહે. સુખશાંતિનગર સીટીએમ રામોલ) એ બિમારીથી કંટાળી તા.૨૩/૭/૧૮ સાજના ૫/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી ભીખુભાઈ ભલાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.